



કોવીડ-૧૯ રસીઓમાં શું છે?

કોવીડ-૧૯ રસીઓમાં પ્રાણીના શરીર કે ઈંડામાંથી લેવામાં આવેલાં (ચરબી, માંસ, લોહી વગેરે જેવાં) કોઈ ઘટક દ્રવ્યો કે પદાર્થો, અથવા ભ્રૂણ (ગર્ભ) કોષો કે તત્વો નથી.

એટલા માટે તે લોકો જેમની ધાર્મિક કે ડાયટરી (આહાર સંબંધી) આવશ્યકતાઓનો અર્થ એ થાય છે કે તેઓ અમુક પ્રકારનું માંસ લઈ શકતા નથી તેમના માટે અથવા જેઓ શાકાહારી ડાયટ (આહાર) પર હોય છે તેવા લોકો માટે એ અનુકૂળ છે.

મૂળ ઘટક દ્રવ્યો કે પદાર્થો મંજૂરીની પ્રક્રિયાના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેની માહિતી નીચેની વેબસાઇટો પર ઉપલબ્ધ છે:

- **Pfizer/BioNTech vaccine:** ફાઈઝર / બાયોટેક વેકસિન:

<https://www.gov.uk/government/publications/regulatory-approval-of-pfizer-biontech-vaccine-for-covid-19>

- **Oxford-AstraZeneca vaccine:** ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનિકા વેકસિન:

<https://www.gov.uk/government/publications/regulatory-approval-of-covid-19-vaccine-astrazeneca>

NHS (નેશનલ હેલ્થ સર્વિસ) દરેકજણને તેમનું પોતાનું રક્ષણ કરવામાં અને જિંદગીઓ બચાવવામાં મદદ કરવા આ વેકસિન (રસી) લઈ લેવા માટે પ્રોત્સાહન આપે છે. આ રસી મુકાવવી કે નહીં તે એક અંગત પસંદગી છે અને તમે તમારો નિર્ણય સચોટ માહિતી અને હકીકતો પર આધારિત હોય એ રીતે કરો એ અગત્યનું છે. આ વેકસિન લેવું કે નહીં તે અંગેનો નિર્ણય કરતી વેળા તમને નીચેનાં માહિતી સ્ત્રોતો મદદરૂપ થઈ રહેશે:

જેઓ મુસ્લિમ ધર્મ પાળતા હોય તેવા લોકો માટે સલાહ

- ઘ મોસ્ક્સ એન્ડ ઈમાસ નેશનલ એડવાઈઝરી બોર્ડ (MINAB)એ મસ્જિદો માટે જુમ્હાના ખુત્બાનું લખાણ તૈયાર કર્યું છે જેમાં મુસ્લિમોએ શા કારણે આ વેકસિન લેવું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે:

<http://minab.org.uk/wp-content/uploads/2021/01/Minab-Khutbah.pdf>

- The British Islamic Medical Association (BIMA) એ મુસ્લિમો માટે બેઉ ફાયઝર બાયોટેક અને ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનિકા વેકસિનની ભલામણ કરી છે અને આને લગતી વિવિધ પ્રકારની માહિતી તૈયાર કરી છે જે લોકોને ઉપયોગી નીવડી શકે છે:

<https://britishima.org/operation-vaccination/hub/>

- જીપી ડૉ આમિર ખાનનો એ સમજાવતો વીડિયો કે આ વેકસિન (રસીઓ)માં કોઈ પ્રાણીજન્ય તત્વો નથી અને તે મુસ્લિમો અને હિન્દુઓ માટે અનુકૂળ / યોગ્ય છે:

<https://twitter.com/DHSCgovuk/status/1352333895002435584>



NHS

● શું હું રમઝાન દરમિયાન આ વેકસિન લઈ શકું છું? શું એનાથી મારો રોઝો તૂટી જશે?

ઈસ્લામિક વિદ્વાનોએ એ બાબતમાં પણ સ્પષ્ટતા કરી છે કે બિન-પોષણયુક્ત હેતુઓ માટે લેવામાં આવતાં ઈજેકશનોથી રોઝો તૂટી જતો નથી એટલે તમે હજી રમઝાન દરમિયાન પણ તમારું વેકસિન લઈ શકો છો, રસી મુકાવી શકો છો.

ધ બ્રિટીશ ઈસ્લામિક મેડિકલ અસોસિયેશને પણ વિશિષ્ટ સલાહ આપી છે જેમાં રમઝાનના રોઝા રાખતા મુસ્લિમોને આ વેકસિન લેવામાં વિલંબ ન કરવા આગ્રહપૂર્વક તાકીદ કરી છે.

જેઓ હિન્દુ ધર્મ પાળતા હોય તેવા લોકો માટે સલાહ

- આ વેકસિનની સલામતી અને અસરકારકતાની ખાતરી કરાવતો, કોરોનાવાયરસ વિષેની હકીકતો સમજાવવા નિઝડન મંદિરે ગુજરાતીમાં એક વીડિયો તૈયાર કર્યો છે:

https://www.youtube.com/watch?v=JGSRtXUlubk&feature=emb_logo

- જીપી ડૉ આમિર ખાનનો એ સમજાવતો વીડિયો કે આ વેકસિન (રસીઓ)માં કોઈ પ્રાણીજન્ય તત્વો નથી અને તે મુસ્લિમો અને હિન્દુઓ માટે અનુકૂળ / યોગ્ય છે: <https://bit.ly/3qWNwtT>

યહૂદી ધર્મ પાળનારાઓ માટે સલાહ

- ધ કોન્ફરન્સ ઓફ યુરોપીઅન રબાઈઝ એ ઓક્સર્ડ-અસ્ટ્રાઝેનિકા વેકસિન બાબત તેમની માન્યતાને લગતાં નિવેદનો પ્રગટ કરેલાં છે:

<https://rabbiscer.org/wp-content/uploads/2020/12/CER-Vaccination-.pdf>

જેઓ શાકાહારી અથવા પ્રાણીજન્ય કોઈ ખોરાક ન ખાતા હોવાની જીવન પદ્ધતિ અનુસરતા હોય તેવા લોકો માટે સલાહ

- વેજિટેરિઅન સોસાયટી: કોવીડ-૧૯ વેકસિન વિષે તમારે શું જાણવાની જરૂર છે:

<https://vegsoc.org/lifestyle/covid-19-vaccines/>

- વિગન સોસાયટી: કોવીડ-૧૯ વેકસિન અંગે પ્રતિક્રિયા - ખુલાસો:

<https://www.vegansociety.com/news/news/vegan-society-response-covid-19-vaccine>